

B.Com. Semester - 1 (NEP-2020) Examination

OCT/NOV-2024

Accounting Standard – 1 (Multidisciplinary course)

Time: 2:00 Hours

Marks: 50

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન-૧ “હિસાબી ધોરણ” સમજાવો. તેનું કાર્યક્ષેત્ર ચર્ચો. (૧૦)
અથવા
- પ્રશ્ન-૧ “આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલ ધોરણો” સમજાવો. તેની મુખ્ય લાક્ષણિકતાઓ ચર્ચો.
- પ્રશ્ન-૨ હિસાબી ધોરણ-૨ મુજબ માલસામગ્રીનું મૂલ્યાંકન સમજાવો. (૧૦)
અથવા
- પ્રશ્ન-૨ હિસાબી ધોરણ-૩ રોકડ પ્રવાહ પત્રક ચર્ચો.
- પ્રશ્ન-૩ ટ્રેકનોંધ લખો (કોઈપણ એક) (૧૦)
(A) હિસાબી ધોરણ-૫: હિસાબી નીતિમાં અગાઉના સમયગાળામાં બદલાવની વર્તમાન સમયગાળાના ચોખ્ખા નફા કે નુકશાન પર અસરો
(B) હિસાબી ધોરણ-૭: બાંધકામના કરારો
અથવા
- પ્રશ્ન-૩ હિસાબી ધોરણ-૪ ના સંદર્ભમાં ‘આકસ્મિકતાઓ’ અને ‘પાકા સરવૈયાની તારીખ પછી ઉઠ્ઠવતી ઘટનાઓ’ વિગતે સમજાવો.
- પ્રશ્ન-૪ હિસાબી ધોરણ ૧૧ મુજબ વિદેશી વિનિમય દરોમાં બદલાવની અસરો પર નોંધ લખો. (૧૦)
અથવા
- પ્રશ્ન-૪ હિસાબી ધોરણ-૯ ઉપજોની ઓળખ ચર્ચો.
- પ્રશ્ન-૫ ટ્રેકનોંધ લખો (કોઈપણ એક) (૧૦)
(A) હિસાબી ધોરણ: ૧૨ સરકારી અનુદાન/સહાયના હિસાબો
(B) હિસાબી ધોરણ: ૧૪ સંયોજન માટેના હિસાબો
અથવા
- પ્રશ્ન-૫ પ્રવર્તમાન સમયમાં હિસાબી ધોરણ – ૧૩ રોકાણો અંગેના હિસાબોનું મહત્વ વિગતે ચર્ચો.

ENGLISH VERSION

- Que-1 Define “Accounting Standard”. Discuss the scope of Accounting Standards. (10)
OR
- Que-1 Define ‘International Financial Reporting Standards’. Discuss Key Features of IFRS In Detail.
- Que-2 Explain Valuation of Inventories as Per AS-2. (10)
OR
- Que-2 Discuss AS -3 Cash Flow Statement.
- Que-3 Write Short Note (Any One) (10)
(A) AS:5 Net Profit Or Loss For The Period, Prior Period Items and Changes In Accounting Policies
(B) AS:7 Construction Contracts
OR
- Que-3 Define the Term ‘Contingencies’ and ‘Events Occurring After Balance Sheet Date’ in context to AS-4.
- Que-4 Explain the effect of changes in foreign exchange rates as Per Accounting Standard: 11. (10)
OR
- Que-4 Discuss Accounting Standard:9 Revenue Recognition
- Que-5 Write Short Note (Any One) (10)
(A) AS: 12 Accounting for Government Grants
(B) AS: 14 Accounting for Amalgamations
OR
- Que-5 Discuss the Importance of AS:13 Accounting for Investments in Present Market Conditions in Detail.
